

## જાહેર વિજ્ઞાપ્તી

કમિશ્નર મહિલા અને બાળ વિકાસની કચેરી, ( મહિલાવીંગ) બ્લોક નં.૨૦,

ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર

“ ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર”

શ્રેષ્ઠ મહિલા સંસ્થા અને શ્રેષ્ઠ મહિલા કાર્યકર માટે

વર્ષ :-૨૦૧૫-૧૬ માટે

ગુજરાત રાજ્યમાં મહિલા વિકાસને લગતી શ્રેષ્ઠ કામગીરી કરતી એક સ્વૈચ્છિક સંસ્થાને અને એક શ્રેષ્ઠ મહિલા કાર્યકરને વર્ષ :-૨૦૧૫-૧૬ માટે ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર એનાયત કરવા સારુ નિયત અરજી પત્રકમાં નીચેની શરતોને આધિન અરજી મંગાવવામાં આવે છે.

૧. સ્વૈચ્છિક સંસ્થા તેમજ મહિલા કાર્યકર જે ઓછામાં ઓછા ૫ વર્ષથી ગુજરાત રાજ્યમાં મહિલા કલ્યાણ ક્ષેત્રે , મહિલા સશક્તિકરણ / આર્થિક સશક્તિકરણને લગતી પ્રવૃત્તિ કરતી હોય તેવી સંસ્થા / મહિલા કાર્યકર પુરસ્કાર માટે આધાર /પુરાવા સાથે અરજી કરી શકશે.
૨. કોઈ પણ સરકારી અથવા તો અર્ધ સરકારી અને ૧૦૦ ટકા સરકારી અનુદાનથી ચાલતી સંસ્થા આ પુરસ્કાર માટે અરજી કરી શકશે નહીં.
૩. સદર પુરસ્કાર સ્વૈચ્છિક સંસ્થા અને મહિલા કાર્યકરને એક જ વખત મળવાપાત્ર છે.
૪. પુરસ્કાર માટે પસંદગી / પધ્ધતિ/ શરતોમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા રાજ્ય સરકારની રહેશે
૫. પુરસ્કાર આપવા અંગે રાજ્ય સરકારનો નિર્ણય આખરી રહેશે.

આ પુરસ્કાર મેળવવા અંગેનું અરજી પત્રક મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબ સાઈટ [www.wcd.gujarat.gov.in](http://www.wcd.gujarat.gov.in) પરથી મળી રહેશે. તેમજ કમિશ્નર મહિલા અને બાળ વિકાસની કચેરી, (મહિલા વીંગ) , બ્લોક નં. ૨૦ ડો. જીવરાજ મહેતા ભવન ગાંધીનગરની કચેરીએથી કચેરી સમય દરમિયાન મળશે.

આ નિયત અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો કાળજી પુર્વક વાંચીને નિયત શરતો મુજબ જરૂરી આધાર પુરાવાઓ સાથે અરજી તા. ૦૫/૦૨/૨૦૧૬ ( કચેરી સમય દરમિયાન) સુધીમાં મળે તે રીતે આર.પી. .એ.ડી.થી મોકલી આપવાની રહેશે. રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં.

નોંધ:- નિયત સમય મર્યાદા પછી મળેલ અરજીઓ આપો આપ રદ ગણાશે

અધિક કમિશ્નર  
મહિલા અને બાળ વિકાસ  
ગાંધીનગર